

G4 Ministerial Joint Press Statement

September 22, 2021

G4 મંત્રીમંડળીય સંયુક્ત પ્રેસ નિવેદન

સપ્ટેમ્બર 22, 2021

1. 22 સપ્ટેમ્બર 2021ના રોજ જી-4 દેશોના વિદેશમંત્રીઓ, મહામહિમ કાર્લોસ આલ્બર્ટો ફાન્કો ફાન્કો, બ્રાઝિલના વિદેશમંત્રી, હેકો માસ, જર્મનીના ફેડરલ વિદેશમંત્રી, ભારતના વિદેશમંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર અને જાપાનના વિદેશ બાબતોના મંત્રી મોટેગી તોશિમીત્સુ, ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર દરમિયાન મળ્યા હતા. પ્રધાનોએ વિકાસશીલ દેશો અને મોટું યોગદાન આપનારાઓ સહિત સમકાલીન વિશ્વની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરીને તેને વધુ કાયદેસર, અસરકારક અને પ્રતિનિધિ બનાવવા માટે સુરક્ષા પરિષદને સુધારવાની તાકીદ પર ભાર મૂક્યો હતો.
2. જી-4 મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રની કામગીરીની સમીક્ષા કરીને એ વાતને બિરદાવી હતી કે એસેમ્બલીએ તેના નિર્ણય 75/569માં તમામ રાજ્યોના વડાઓ અને સરકારના પ્રતિબદ્ધતાને "સુધારા પરની ચર્ચામાં નવું જીવન સ્થાપિત કરવા માટે સુરક્ષા પરિષદ", યુનાઇટેડ નેશન્સ (એ/આરઇએસ/75/1)ની 75મી વર્ષગાંઠની ઉજવણી અંગેના ઘોષણાપત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં, મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની આવશ્યકતા પૂરી પાડવાની તૈયારીને પણ આવકારી હતી. 10 સપ્ટેમ્બર 2021ના પોતાના અહેવાલમાં "આપણો સામાન્ય એજન્ડા"માં તેનો ઉલ્લેખ છે. મંત્રીએ વધુમાં એ બાબતને આવકારી હતી કે આંતર-સરકાર વાટાઘાટો (આઇજીએન)ના સહ-અધ્યક્ષો દ્વારા તૈયાર કરાયેલું એલિમેન્ટ્સ પેપર વિકસ્યું છે જેમાં સભ્ય રાજ્યોના આંશિક યોગદાન અને દરખાસ્તો છે.
3. જી-4ના મંત્રીઓએ સામાન્ય સભામાં વાગુ કરવાના હેતુથી એક જ દસ્તાવેજના આધારે, આઇજીએનમાં વધુ વિલંબ કર્યા વગર ટેક્સ્ટ-આધારિત વાટાઘાટો શરૂ કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનોએ આ માટે સંયુક્ત રાષ્ટ્રને તેમના પ્રતિનિધિમંડળને 76મી સામાન્ય સભાના અધ્યક્ષ અને આઇજીએનની અધ્યક્ષના પ્રયત્નોને ટેકો આપવા અને એક એકીકૃત ટેક્સ્ટને ડ્રાફ્ટ રિઝોલ્યુશનના એક આધાર તરીકે વિકસાવવાની રીતોને ઓળખવા સૂચના આપી હતી. નિશ્ચિત સમયમર્યાદામાં નક્કર પરિણામો મેળવવા માટે પ્રધાનોએ અન્ય સુધારાત્મક દેશો અને જૂથો સહિત તમામ રસ ધરાવતા સભ્ય દેશો સાથે સંવાદને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય કર્યો હતો.

4. જી-4 પ્રધાનોએ એ બાબતની પુનઃપુષ્ટિ કરી કે કાયમી અને બિન-કાયમી બેઠકોના વિસ્તરણ દ્વારા સુરક્ષા પરિષદમાં સુધારો કરવો અનિવાર્ય છે, જેથી સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિની જાળવણી માટે સતત જટિલ અને વિકસતા પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકે. આ રીતે સુરક્ષા અને તેના દ્વારા તેની ફરજોને વધુ અસરકારક રીતે નિભાવવામાં આવે. આ સંદર્ભમાં મંત્રીઓએ એઝુલ્વિની સર્વસંમતિ અને સિર્ટે ઘોષણામાં દર્શાવ્યા મુજબ કોમન આફ્રિકન પોઝિશન (સીએપી) ને પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો હતો.

5. જી-4 પ્રધાનોએ સુધારેલા સુરક્ષા પરિષદમાં નવા કાયમી સભ્યો તરીકે એક બીજાની ઉમેદવારી માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

ન્યૂ યોર્ક

સપ્ટેમ્બર 22, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.